



અડદની પૈશાનિક ખેતી પદ્ધતિ

શ્રી ભરતભાઈડે. પટેલ – ડૉ. રમેશભાઈ એ. પટેલ – ડૉ. મનીષકુમાર વી. પટેલ

: પ્રકાશક :

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર

ગાણપત યુનિવર્સિટી

મહેસાણા-ગોક્રારીયા હાઇવે, ગાણપત વિધાનગર-૩૮૪૦૧૨
તા. જી. મહેસાણા. ફોન : ૦૨૭૯૨-૨૮૯૯૮૯, ૭૭૭૮૦૩૩૪૭૧

E-mail. kvkmehsana@yahoo.co.in - kvkmehsana@gmail.com
Website : www.kvkmehsana.org

અડદ એક અગત્યનો કઠોળ પાક છે, જે દાળ, પાપડ, ભુસુ, ઈડલી અને ઢોંસા બનાવવામાં પાણ તેનો ઉપયોગ થાય છે. અડદનું ગોતર દૂધાળા પશુ માટે સાત્વીક ખોરાક છે અને સારુ વળતર આપે છે. અડદમાં ૨૪% પ્રોટીન તથા ૬૦% કાર્બોનિટ પદાર્થો હોય છે. અડદ ૧.૫% એમીનો એસીડ, વિટામીન અને ક્ષારો ધરાવે છે. અડદ દ્વારા જમીનમાં એક હેક્ટરે ૭૦ કિ.ગ્રા. જેટલો નાઈટ્રોજન ઉમેરાય છે.

આબોહવા : -

સામાન્ય રીતે ગુજરાતમાં તેનું વાવેતર ચોમાસામાં કરવામાં આવે છે. પરંતુ ઉનાળામાં તેનું વાવેતર કરી શકાય છે. પાકને ગરમ અને સ્કૂલ હવામાન વધુ માફક આવે છે.

જમીન : -

રેતાળ, બેસર તથા કાળી જમીન માફક છે. ક્ષારીય અને ભાસ્મીક જમીન અનુકૂળ નથી.

જમીનની તૈયારી : -

વિધા દીઠ ૨.૫ ટન છાણીયું ગળતીયું ખાતર આપી ડ્રેક્ટર/ બળદની બે લિંડી બેડ કરી, કરબ મારી જમીન તૈયાર કરવી.

જતની પસંગી : -

સુધ્યારેલ બિયારણ ગુજરાત અડદ-૧ અને ટી-૬ જતની ભલામણ કરેલ છે. ગુજરાત અડદ-૧ જત વહેલી પાકતી (૬૫ થી ૭૦ દિવસ) તેમજ મધ્યમ રોગ પ્રતિકારક શક્તિ (ભૂકી છારો અને સરકોસ્પોરા, પાનના ટપકાનો રોગ) ધરાવે છે. આ જતનો દાણો મધ્યમ કદનો અને રંગ લીલાશ પડતો કાળો છે અને ટી-૬ જત કરતાં ૧૪% વધુ ઉત્પાદન આપે છે.

બિયારણનો દર તથા બીજ માવજત : -

૪ થી ૫ કિ.ગ્રા./વિધા પ્રમાણિત બીજની જરૂર પેડે છે. બીજ જન્ય રોગોથી બચવા થાયરમ કે કાર્બેન્ડાઈમ (૩ ગ્રામ દવા/કિ.ગ્રા. બીજ) ની માવજત આપવી. બીજને રાઈઝોબિયમ કલ્ચર ૨૫૦ ગ્રામ પ્રતિ ૮ થી ૧૦ કિ.ગ્રા. બીજ પ્રમાણે પટ આપી વાવેતર કરવું.

વાવણી સમય : -

ચોમાસામાં જૂન અથવા જૂલાઈ માસમાં વાવણી કરવી. ઉનાળું ઋતુમાં માર્યના પ્રથમ અઠવાડીયામાં વાવણી કરવી.

વાવળી અંતર : -

બે હાર વચ્ચે ૩૦ થી ૪૫ સેમી અને બે છોડ વચ્ચે ૧૦ સેમી અંતર રાખવું.

રાસાયણિક ખાતર : -

૨.૫ કિ.ગ્રા. નાઈટ્રોજન અને પ કિ.ગ્રા. ફોસ્ફરસ વિધા દીઠ આપવાની ભલામણ છે. આ માટે વિધે ૧૧ કિ.ગ્રા. ડિ.એ.પી., બીજની નીચે ખાતર પડે તે રીતે બીજને વાવતાં પહેલા ચાસમાં આપવું. ૪મીનમાં સલ્ફરની ઊણાપ હોય તો વિધે પ કિ.ગ્રા. સલ્ફર આપવું. સલ્ફર આપવાથી દાળાની ગુણવત્તા સારી અને ઉત્પાદન વધુ મળે છે.

નિંદાણ અને આંતર ખેડ : -

એક થી બે હાથ નિંદામણ તથા આંતર ખેડ કરવી. મજૂરોની અછત હોયતો પેન્ડીમીથાલીન ૮૦૦ મીલી અથવા આઈસોપ્રોટયુરોન ૨૫૦ ગ્રામ પ્રમાણે નિંદાણનાશક દવા પ્રતિ વિધે બીજને વાવળી પછી અને બી-સ્કુરણ થતાં પહેલા જમીન ઉપર પંપથી છાંટવાથી નિંદાણનું નિયંત્રણ કરી શકાય છે.

પિયત : -

વાવળી બાદ વરસાદ ખેંચાય અને ૪મીનમાં બેજની ખેંચ જણાય તો ફૂલ અને શીંગો અવસ્થાએ (કટોકટી અવસ્થા) પિયતની સગવડ હોય તો પિયત આપવું. ઉનાણું પાક માટે ૬ થી ૧૦ દિવસના ગાળે ૪ - ૬ પિયત આપવા જોઈએ.

આંતર પાક / મિશ્ર પાક પદ્ધતિ : -

ચોમાસાના પાકો જેવા કે જુવાર, મકાઈ, બાજરી, તુવેર અને કપાસ સાથે અડણો પાક અથવા મિશ્રપાક તરરીકી લઈ શકાય.

પાક સંરક્ષણા : -

ચૂસિયા પ્રકારની જીવાત જેવી કે સફેદ માખી, તડતડીયા અને મોલો માટે લીમડાનું તેલ ૫૦ મીલી અથવા ડાયમિયોએટ ૧૦ મીલી અથવા મિથાઈલ-ઓ-ડીમેટોન ૧૦ મીલી અથવા ઈમિડાકલોપ્રીડ ૬ મીલી અથવા થાયોમેથોકઝામ ૩-૪ ગ્રામ અથવા એસીટામેપ્રીડ ૩ ગ્રામ પ્રમાણે ૧૦ લીટર પાણીમાં લેળવી છાંટકાવ કરવો. લીલી દીયળ જેવા મળે તો પ્રોફેનોફોસ અથવા કિવેનાલફોસ ૨૫% દવા ૨૦ મી.લી. પ્રમાણે ૧૦ લીટર પાણીમાં લેળવી છાંટકાવ કરવો.

માન્ડેક (પંચરગ્નિયા)નો ફેલાવો અટકાવવા માટે ચૂસીયા પ્રકારની જીવાતનું નિયંત્રણ કરવું. ભૂકીછારો તથા પાનના ટપકાંના રોગના નિયંત્રણ માટે ૧૦ મીલી

હેક્સાકોનાજોલ અથવા પ ગ્રામ કાર્બેન્ડાઈમ પ્રતિ ૧૦ લીટર પાણીમાં લેળવી ૧૨ દિવસના અંતરે છંટકાવકરવો.

કાપણી :-

અડાનો પાક ૭૦ થી ૮૦ દિવસે તૈયાર થાય છે. જ્યારે મોટા ભાગની શીંગો કાળી પડી જય ત્યારે પાકની કાપણી કરવી જોઈએ. શીંગોને ખળામાં સુકાવા દઈદ્રેક્ટર અથવા બળદથી મસણીને દાણા છૂટા પાડવા. દાણાનો સંગ્રહ કરો ત્યારે ૮ થી ૧૦% થી વધુ બેજ ન હોવો જોઈએ.

ઉત્પાદન :-

૨૦૦ થી ૨૫૦ કિ.ગ્રા./વિધા.

: વધુ માહિતી માટે :

નામ	વિષય	મોખાઈલનંબર
ડૉ. મનીષભાઈ વી. પટેલ	બાગાયત	૬૬૨૫૨૭૭૭૧૪
શ્રી ભરતભાઈકે. પટેલ	પાક ઉત્પાદન	૬૮૭૬૮૨૦૮૧૮
ડૉ. રમેશભાઈ એ. પટેલ	પાક સંરક્ષણ	૬૪૨૭૬૬૨૮૦૫
ડૉ. શરદ એમ. સોની	પશુપાલન	૬૨૨૮૩૩૨૬૮૧
શ્રી મુકેશભાઈ આર. પટેલ	વિસ્તરણ શિક્ષણ	૮૫૧૧૨૨૧૧૫૮
કુ. રીનાબેન આર. પટેલ	ગૃહવિજ્ઞાન	૬૪૨૭૬૫૦૩૮૨

ચોમાસે કરબુદ્ધ ભલો,
શિયાળે હુણ-ખેડ,
દિનાંણે દાંતી ભલી,
ખુરપી બારે માસ.

